



Corporate Office: 15,16 & 17, Maker Chambers-III, 1st Floor, Jamnalal Bajaj Road, Nariman Point, Mumbai 400 021 Tel.: 91 22 4353 0400 • E-mail: bluechiptex@gmail.com • Website: bluechiptexindustrieslimited.com

CIN: L17100DN1985PLC005561

Date: 21st January, 2021

To,
Dept. of Corporate Services (CRD) **BSE Limited**Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai – 400 001

Scrip Code: 506981

Subject: Newspaper Advertisement pertaining to Meeting of the Board of Directors

Dear Sir / Madam,

In compliance with the provisions of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we hereby submit copy of newspaper advertisement published on 21st January, 2021 in newspapers viz. Business Standard (In English) and Western Times (In Gujarati) informing about the Board of Director's Meeting to be held through video conferencing on Friday 29th January, 2021 at 3.00 p.m.

The aforesaid information is also available on the website of the Company at www.bluechiptexindustrieslimited.com.

Thanking you,

Yours faithfully,

For Blue Chip Tex Industries Limited

Shahin .N. Khemani Managing Director DIN: 03296813

Encl.: a/a



Where's the bias? SC says farm panel has no power

New Delhi, 20 January

Supreme Court on Wednesday expressed strong displeasure over the aspersions cast by some farmers' unions on members of the court-appointed committee to resolve the impasse over new farm laws and said it has not given any adjudicating authority to the panel

"Where is the question of bias in this? We have not given adjudicating powers to the committee. You don't want to appear is understandable, but casting aspersions on someone because he expressed his view is not done. You don't need to brand anybody like this," said the bench, also comprising Justices A S Bopanna and V Ramasubramanian.

The top court said that it has serious reservations that committee members were called names and branded, which has "become a cultural thing now"

Meanwhile, the hopes of Delhi Police to get a judicial order to stop the proposed tractor rally by the protesting farmers on the Republic Day in the national capital were dashed as the top court asked the Centre to withdraw the plea, saying it was a "police matter" and was not an issue for the "court to pass orders".

A bench headed by Chief Justice S A Bobde said, "You malign people according to public opinion. I am very disappointed and sorry to see the kind opinion which has been appearing in this press" and questioned, "How can you malign them just because they have expressed some



Farmers conduct rehearsal for their tractor rally ahead of the Republic Day PHOTO:PTI

prising Justices A S Bopanna and V Ramasubramanian issued notice and sought response from Centre in two weeks on a separate plea of 'Kisan Mahapanchayat', a farmers' body from Rajasthan, seeking removal of three remaining members of the apex-court appointed panel and the replacement of Bhupinder Singh Mann, who had recused himself from the panel. Taking note of submissions of a lawyer that opinions on the panel members have been formed on the basis of media reports about their profarm laws views, the bench said, "You people unnecessarily cast aspersions. Can the people expressing their views in some other context, be debarred from the comviews in the past?" The bench also com- mittee? The CJI said, "One of the com-

mittee members Sardar Bhupinder Singh Mann had called for amendments in the law. Does this mean a person expressing his opinion cannot be in a committee? You cannot brand people like this. People should have an opinion. Why should people not have an opinion? Even judges do have and express their opinions". The bench said, "Everyone argues before a judge as if he is arguing on a clean slate but branding people has become a cultural thing now. Even judges express views during hearing. That doesn't mean they can't decide an issue.

On January 12, the top court had stayed

the implementation of the contentious new farm laws till further orders and constituted the four-member committee.

Pay farmers before delivery to avoid row: Paper

New Delhi, 20 January

Amid the ongoing farmer protests at Delhi's borders against the three farm Acts, a discussion paper was pre-

sented during the National Indian Agriculture in 2030, organised by the NITI Aayog and Food and Agriculture Organisation (FAO).

need to be paid on the same Acts. This could be in the

day either in cash or electron- form of some agency or inter- They must also push for ically before delivery of their mediary that could facilitate speedy implementation of produce in a trade area (classified as an area outside the jurisdiction of a regulated APMC). This will lower the possibility of disputes and eliminate the chances of going to a sub-divisional

oversight and regulation for state governments, on their in reducing the transaction trading on an electronic plat-The paper said farmers form as facilitated by the print for entry of the private them with grading and stand-

magistrate for settlement.

transactions between farmers or aggregators and the buyers.

The paper, written by researcher Seema Bathla and former agriculture secretary Siraj Hussain, said while the three agriculture Acts will It also called for better have far-reaching impact, the and agri start-ups that help part, need to draw up a bluesector in agriculture markets. ardisation facilities.

the regulations specified in the respective Acts.

The paper also said appropriate institutional arrangements have to be made for aggregators, farmer-producer companies (FPCs), self-help groups (SHGs), co-operatives cost of farmers and provide

▶ FROM PAGE 1

Srinivasan...

ance is something which made the jury vote in favour of Federal Bank. There had been a couple of other contenders with equally strong data set and decent performance, but the jury noted and recognised that these turnarounds in peratively recent origin and of under review. shorter duration, and probably it would be important for the jury to wait and watch the performance for a relatively longer period to establish the consistency," said Mundra, chair of the jury.

The jury judged Srinivasan as the best choice for an impressive, all-round performance of the bank.

The bank had strong ratios, adequate provisioning, and low non-performing assets (NPA) ratio. Although more regioncentric than other banks. Srinivasan has made the bank's brand recognisable over the years, but did not want to grow aggressively compromising on asset quality or provisioning.

The filters used for the jury table were banks with the asset size of ₹50.000 crore and above as of March 2020, and that there should have been growth in profit prior to provision in the past three years. Only 11 banks qualified, which was further filtered down to five.

The jury discussed threadbare the financials of these five banks, and narrowed down to three purely on qualitative aspects. Issues such as leadership, regulatory actions, etc., and style of leadership were discussed.

The jury appreciated Federal Bank's overall performance year after year, without any undue surprise. The bank's net NPA was 1.31 per cent as on March 31, 2020. Importantly, it has fallen in the past three years in consideration, whereas many have witnessed fluctuations. The bank is also one of the few which reported net formances have been of rel- profit in the last three years things to get back to normal."

at₹1,543 crore for the year ended March 31, 2020, registering 24 per cent growth year-on-year.

Govt wants...


"We are operating with too many restrictions. We should get back to an open and free world as quickly as possible," the airline's CEO Ronoiov Dutta had recently said in an interview.

rivals However, SpiceJet, Go Air and AirAsia India have told the government that with capacity and fare cap removed, IndiGo's expansion will increase their losses. One of the CEOs has even told the government that there can be cases of bankruptcy too. according to sources.

"Anyway, Q4 is a weak quarter for airlines as January-March remains a lean season after the high of the festival month in October and year end travel in December. It is severely worse this year as there's hardly any forward bookings. It will be very difficult to profitably deploy any more capacity," said head of

While civil aviation minister

BS SUDOKU # 3262



HOW TO PLAY

Fill in the grid so that every row, every column and every 3x3 box contains the digits 1 to 9

commercial of an airline.

Easy: $\star\star$



Solution tomorrow

)	LU	TIC	N	TO	ii ii ii	#	32	261
	3	9	2	6	4	7	8	5
	4	2	5	9	8	1	6	3
,	5	8	3	1	7	2	4	9
ı	6	7	4	2	5	3	1	8
	1	5	6	8	3	9	7	4
Ī	Q	3	1	7	a	5	2	6

Hardeep Singh Puri has been optimistic about airlines regaining the pre-Covid capacity by end of December, bureaucrats believe the aviation sector may take longer to return to normalcy. Aviation secretary Pradeep Singh Kharola said, "I don't think the bad period is over. It will take another two-three months for

id the higgest worry is the absence of business travellers who buy costly tickets making it possible for airlines to offer cheaper fares to vacationers.

Cricket hits...

Media planners say that the gaming, fintech, and edtech start-ups are leading the race for sponsorships deals, much like they did during the Indian Premier League (IPL) in September last year. Dream11 emerged the title sponsor for the IPL, pipping Byju's and Unacademy.

On television, Dream11 came on board as co-presenting sponsor along with PhonePe, Amazon, and Byju's during IPL 2020. There were associate sponsors across categories, such as cable and wires (Polycab India), fast-moving consumer goods (Procter & Gamble, ITC, Mondelez India, and Coca-Cola), online rummy (Rummy Circle), and financial services (Association of Mutual

Funds in India), among others. Incidentally, IPL this year will revert to its Springtime schedule, coming right after the India-England bilateral series, implying that Star Sports — the official broadcaster of the IPL — will have two tournaments to sell backto-back in the first half of 2021.

While that is a handful, some media planners and experts say that categories riding the summer season will hop on board. "There will be no dearth of advertisers for the IPL this year, despite a surfeit of cricket," says Karan Taurani, vice-president-research, Elara Capital, adding, "Small and large advertisers will be keen to invest in the property."

Cricket certainly seems the flavour of the season this year.

Govt ready...

Seeing that the negotiations

were reaching a dead end, Tomar offered to hold back the implementation of the

been staved till further orders by the Supreme Court, which has formed a committee to resolve the deadlock. The committee, which had

The laws, meanwhile, have

its first meeting on Tuesday and will begin consultations Analysts tracking the sector with various stakeholders on Thursday has been asked to give its report in two months.

Farmer leaders also raised the issue of notices being served to some of them by the National Investigation Agency, alleging it was being done to harass those supporting the agitation. The government representatives said they would look into the matter.

Before the meeting, the three ministers met Union Home Minister Amit Shah.

In the last round of talks, the government had asked the farmers to prepare a proposal about their objections and suggestions on the three farm laws.

Bhartiya Kisan Union President Bhupinder Singh Mann has recused himself from the committee appointed by the apex court. Shetkari Sanghatana

(Maharashtra) President Anil Ghanwat and agricultural economists Pramod Kumar Joshi and Ashok Gulati are the other three members on the

Under attack from protesting unions for their "pro-government" public stand on the three laws, the members of the committee have said they will keep aside their own views while consulting the various stakeholders, even as they indicated a repeal won't augur well for agricultural reforms.

Earlier in the day, a group of farm union leaders met top police officials of Delhi, Haryana, and Uttar Pradesh to discuss the route and arrangements for their tractor rally on January 26 to protest against the three farm laws.

The Supreme Court on Wednesday expressed displeasure over the aspersions cast by some farmers' unions on the members of the courtappointed committee, saying no adjudicating authority had been given to the experts, who would just hear their grievances and give a report.

Floor, Muljinagar Building No.1 Co-operative Housing Society Ltd., S.V. Road, Borivali (West), Mumbai-400 092, (hereinafter referred to as "THE SAID FLAT") and MR. VIJAY SHYAMLAL SHAKMA is a bonande member of Muljinagar Building No.1 Co-operativ Housing Society Ltd., and is holding Shar Certificate No.21 consisting of five shares of the State Society. My client MR. VIJAY SHYAMLAL SHARMA intends to sale his Flat No. B/1 to any Prospective Buyer/s.

dverse, legacy, possession, lease, leave and cence, lien or otherwise howsoever and ereby required to make known to the ddress within 14 days from the date of ublication with documentation proof in writing legal evidence otherwise my client w MUMBAI DATED: 21/01/2021.

BHAVYA LAW AND ASSOCIATES,

201 2nd Floor Man Mandir Building No 4 para (West), District : Palghar-401 203

Lost/Misplaced

signed below Mr. Rajesh Chandulal Gandh age 62, resident 1601, Balaji Garden, Opp. Indian Gymkhana, Matunga (East), Mumbai - 400019 do hereby publicly notice that. The original purchase agreement o KOMPRESS INDIA PVT. LTD., pertaining to Plot No. A-526/527 TTC Industrial Area M.I.D.C. Mahape Thane - Belapur Road, Nav Mumbai - 400 701) is lost / missing of misplaced and giving on the said property and formal complaint has been lodged a Matunga Police Station, Mumbai or 26.11.2020 and further stating that we wis to create charge on the said property for vailing loan/credit facility.

If anyone finds these documents pleas contact us at the mentioned address or a the following mobile number or anyone has any objection of, contact within 7 days from the date of published of this notice.

> RAJESH CHANDULAL GANDH KOMPRESS (INDIA) PVT. LTD.

WESTERN RAILWAY

PROCUREMENT OF BOX TYPE GAUGE CUM LEVEL (BG) GAUGE CUM LEVEL (BG)
Notice Invitting Tender: E-Procurement
Tender Notice No. STM JANUARY 2021
5 TENDER dated 19.01.2021 for
publication. Chief Engineer, Western
Railway, Churchgate invites the following
E-Procurement Tender: Tender No.:
W628-03-20-05 Description of stores
tender: Procurement of Box type Gauge
cum Level (BG) along with Spirit Level
as per RDSO specification no.TM-58
dated 11.08.2001(for BG) and RDSO
specification no.TM-52 dated 24.05.2000
(for Spirit Level). Quantity in Nos.: 367 specification no.TM-52 dated 24.05.2000 (for Spirit Level). Quantity in Nos.: 367 Total Tender Value in Rs.: 12.12.568.00 Earnest Money in Rs.: Exempted Date of Closing of e-Tender Box at 11:00 Hrs: 16.02.2021 Date of Opening of e-Tender Box at 11:15 Hrs: 16.02.2021 Note: 1. The complete information along with tender document of above e-Procurement Tender is available in website on https://ireps.gov.in. up to the due date of tender opening. 2. Bids other than in the form of E-Bids shall not be accepted against above Tenders. For this purpose, vendors are required to get themselves registered with IREPS website along with class III Digital signature certificates issued by CCA under IT Act-2000. 593

Like us: www.facebook.com/Wes

BLUE CHIP TEX INDUSTRIES LIMITED CIN: L17100DN1985PLC005561 Registered Office: Plot No. 63-B.

Piparia, Silvassa 396 230 Dadra & Nagar Haveli Email Id: bluechiptex@gmail.com NOTICE

Notice is hereby given pursuant Regulation 29 read with bligations and Disclosure lequirements) Regulations, 2015 ctors of the Company will h ld through video conferencing Friday 29th January, 2021 a .00 p.m., to consider and approv ne Un-Audited Financial Result

By order of the Board of Directors For Blue Chip Tex Industrie

ecember 2020 with limited

eview report thereon by the

Limite Shahin .N. Khemar Managing Directo

DIN: 0329681

Date: 20th January, 2021 more information please www.bseindia.com ww.bluechiptexindustrieslimited.co

PUBLIC NOTICE TAKE NOTICE THAT the Seller Mr

Anil Vasant Purarkar is intending to sel transfer, convey and assign his right, title and interest and our clients are intending to purchase the property described in the cumbrances

Any person having any claim or righ respect of the said property by way o nheritance, share, sale, mortgage, lease lien, license, gift, possession o hereby required to intimate to the undersigned within 14 days from the date of publication of this notice of his/ her/ thei such claim, if any, with all supporting documents failing which the transaction shall be completed without reference to such claim and the claims, if any, of such person shall be treated as waived and no inding on our clients.

THE SCHEDULE **ABOVE REFERRED TO**

Flat No. 1203 situate on the 12th Floo n the building known as Bhavna Apartme constructed on land bearing CS No. 259 260 (part) of Parel Sewree Division situate at Parel Back Road, Dr. Walimbe Road Parel Village, Parel, Mumbai 400 012 admeasuring 435 sq. ft. (carpet) along with one car parking space bearing No. 6-C.

Date: 21.01.2021 For India Law Alliance Kiran Padalka

Advocates for the Intending Purchaser 1st Floor, Surva Maha 5, Burjorji Bharucha Marg Fort, Mumbai 400 023

DHRUV ESTATES LIMITED

Read, Office: B-709, Sagar Tech Plaza, Andheri Kurla Road, Sakinaka Junction, Andheri (East), MUMBAI - 400072

UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 31ST DECEMBER-2020

PARTICULARS	3 months ended 31.12.2020	Preceding 3 months ended 30.09.2020	Correspond- ing 3 months ended in the Previous year 31.12.2019	Year to date Figures for Current Period ended 31.12.2020	Year to date Figures for Previous year ended 31.12.2019	Previous Year ended 31.03.2020
	(Unaudited) Rs.	(Unaudited) Rs.	(Unaudited) Rs.	(Unaudited) Rs.	(Unaudited) Rs.	(Audited) Rs.
1. Income						
(a) Revenue from Operations	l o	0	50000	0	50000	50000
(b) Other Income	16758	Ö	169117	19762	489479	373466
Total Income	16758	Ö	219117	19762	539479	423466
2. Expenses	10.00		2.0	7.0.02		
(a) Cost of Sales	0	0	0	0	0	0
(b) Employee benefit expenses	Ŏ	900	ŏ	900	ŏ	900
(c) Change in inventories	اة	0	ő	0	Õ	0
(d) Finance Costs	ا م	ō	ō	ō	Ō	ō
(e) Depreciation and amortization expenses	ا م	ō	ō	ō	Ö	ō
(f) Other Expenses	126320	92086	117350	233319	678804	777282
Total Expenses	126320	92986	117350	234219	678804	778182
Profit/Loss before exceptional items and	.20020	02000		20.2.0	0.000.	
tax (1-2)	-109562	-92986	101767	-214457	-139325	-354716
4. Exceptional Items	0	0	0	0	0	0
5. Profit/Loss before Tax (3 + 4)	-109562	-92986	101767	-214457	-139325	-354716
6. Tax Expenses						
Current Tax	0	0	0	0	0	0
Deferred Tax	ا م	Ō	ō	0	Ō	0
7. Profit/Loss after Tax (5-6)	-109562	-92986	101767	-214457	-139325	-354716
8. Other comprehensive Income						
a) Items that will not be reclassified to						
Profit and loss (net of tax)	0	0	0	0	0	0
b) Other comprehensive income	ا آ	ō	ō	ō	ō	ō
9. Total other comprehensive Income for						
period (7+8)	-109562	-92986	101767	-214457	-139325	-354716
10. Paid up Equity Share-capital	. 30002				.50020	
(Face value of Rs. 10/- per share)	9623000	9623000	9623000	9623000	9623000	9623000
11. Earning per equity share (not annualized)						
Basic (Rs.)	-		_	-	-	-
Diluted (Rs.)	-		_	_		

The Statutory Auditors of the Company have carried out the Limited Review of the unaudited standalone financial results for the quarte ended December 31, 2020, in accordance with Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Required Regulations, 2015 and approved by the Board of Directors at their meeting held on 20th January 2021

The figures for the previous quarter(s) have been regrouped/rearranged, wherever necessary No investors' complaints were pending at the end of the quarter.

For DHRUV ESTATES LIMITED

Place: Mumbai Date: 20.01.2021

Saniav Kanungo Managing Director DIN:00568508

NOTICE

Sub: Transfer of Equity shares & Unpaid Dividend of the Company to Investor Education and Protection Fund (IEPF) Authority

This Notice is published pursuant to the applicable provisions of the Companies Act, 2013 read with Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 [Rules] notified by the Ministry of Corporate Affairs and subsequent amendment thereof. The said Rules inter-alia, contain provisions for transfer of all shares and transfer of unpaid or unclaimed dividend to IEPF in respect of which dividend has not been paid or claimed by shareholders for seven consecutive years or more.

The Company has sent individual notices to concerned shareholders, whose shares and dividend are liable to be transferred to IEPF Authority to their latest available addresses. The Company has displayed full details of the such shareholders, dividend and shares on its website at skf.com/in. Shareholders are requested to verify the details of the shares liable to be transferred as aforesaid.

In case the Company does not receive any communication from the concerned shareholders on or before April 30, 2021, the Company shall with a view to complying with the requirements of the Rules, will proceed to transfer the equity shares and unpaid dividend to

The shareholders holding shares in demat mode, Delivery Instruction Slip signed by the Company on behalf of the shareholder will be issued to the concerned Depository Participant. The Depository will thereupon effect the transfer of the shares in favour of IEPF in its records, as required under the Rules. In respect of shares in physical mode that are liable to be transferred to IEPF Authority, may

share certificate(s) held by them for this purpose. Upon such issue, the original share certificate(s) will stand automatically cancelled and hence cannot be traded. The shares and unclaimed dividends transferred to IEPF Authority including all benefits accruing on shares if any, can be claimed back by the shareholders from IEPF Authority after

following the due process prescribed under the Rules. No claim shall lie against the

note that the Company would be issuing duplicate shares certificate(s) in lieu of the original

In case the shareholders have any queries on the subject matter, they may contact the Company's Share Transfer Agent, M/s TSR Darashaw Consultants Private Limited, at 6-10 Haji Moosa Patrawala Industrial Estate, 20, Dr.E. Moses Road, Mahalaxmi, Mumbai 400011,

Tel: +91 22 66568484, e-mail: csg-unit@tsrdarashaw.com

For SKF India Limited Ranjan Kumar **Company Secretary**

SKF.

kotak

Mumbai 18th January, 2021

Charni Road (W), Mumbai: 400 002.

Mr. Sandeep Ramkrishna Mahale (Borrowe

Mr. Pravin Ramkrishna Mahale (Co-Borrowe

5. Loan A/c. No.: HF12491030 & HF12491014

Mr. Vijay Prahlad Karande (Borrower)

Mrs. Pooia Viiav Karande (Co-Borrower)

Loan A/c. No.: HF37789460 & HF37868995

CIN L29130MH1961PLC011980

E-mail: investors@skf.com

Mahatma Gandhi Memorial Building, Netaji Subhash Road,

SKF India Limited

Fax: +91 22 22819074

Website : skf.com/in

KOTAK MAHINDRA BANK LIMITED

Registered office : 27 BKC, C 27, G Block, Bandra Kurla Complex, Bandra (E), Mumbai-400 051 Corporate Office : Kotak Infinity, Zone-II. 4th Floor, Bldg. No. 21, Infinity Park, Off. W. E. Highway, Goregaon, Mumbai-400 097: Branch / Regional Office : 159-A, Vinay Bhava Complex, 5th Floor, CST Road, Kalina Santacruz-400 098

DEMAND NOTICE Under Section 13(2) of the Securitisation And Reconstruction of Financial Assets And Enforcement Of Security Interest Act, 2002 read with Rule 3 (1) of the Security Interest (Enforcement) Rules, 2002. The undersigned is the Authorised Officer of Kotak Mahindra Bank

Ltd. (KMBL) under Securitisation And Reconstruction Of Financial Assets And Enforcement of Security Interest Act. 2002 (the said Act) In exercise of powers conferred under Section 13(12) of the said Act read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, the Authorised Officer has issued Demand Notices under section 13(2) of the said Act, calling upon the following Borrower(s) (the "said Borrower(s)"), to repay the amounts mentioned in the respective Demand Notice(s) issued to them that are also given below. I connection with above, Notice is hereby given, once again, to the said Borrower(s) to pay to KMBL, within 60 days from the publication of this Notice, the amounts indicated herein below, together with further interest as detailed in the said Demand Notice(s), from the date(s' mentioned below till the date of payment and/or realization, payable under the loan agreement read with other documents/writings, i any, executed by the said Borrower(s). As security for due repayment of the loan, the following assets have been mortgaged to KMBL by the said Borrower(s) respectively.

ir. Io.	Loan Account No. / Name of the Borrower(s) / Guarantor(s)	Demand Notice, Date and Amount	Description of Secured Asset (Immovable Property)		
1.	Loan A/c. No.: RHB-1071605 & RHB-1071436 1. Mr. Amit Babulal Jain (Borrower) 2. Mrs. Joolie Amit Jain (Co-Borrower)	Demand Notice Date: 04.01.2021 ₹ 69,02,536.69 (Rs. Sixty Nine Lakh TwoThousand Five Hundred Thirty Six and Sixty Nine Paise only) as on 04.01.2021	Mortgage over following proper :- Flat No. 302, 3 rd Floor, B-Win Dhanashree CHSL., Veer Savarkar Roa Dombivali (E), Maharashtra-421201.		
2.	Loan A/c. No.: ILAP16059 1. Mr. Chandrakant Nandlal Agarwal (Borrower)	Demand Notice Date: 01.01.2021 ₹ 43,72,555.58 (Rs. Forty Three Lakh Seventy Two Thousand Five Hundred Fifty Five and Fifty Eight Paisa Only) as on 01.01.2021	Mortgage over following property Flat No. 502, 5 th Floor, E-Wing, Adn 640 Sq. Fts., Sankara Colony Implosic CHSL., P L. Lokhande Marg, Govand Mumbai-400 043.		
	Loan A/c. No.: HF-37312761 1. Mr. Padmanabh R. Dani (Borrower) 2. Mr. Vivek Padmanabh Dani (Co-Borrower) 3. Heena P. Dani (Co-Borrower)	Demand Notice Date: 04.01.2021 ₹ 41,98,408.77 (Rs. Forty One Lakh Ninety Eight Thousand Four Hundred & Eight & Seventy Seven Paisa only) as on 29.12.2020	Mortgage over following propert:- All that piece & parcel of Flat Not 1901 Lareina Residency Hariyali Vill Behind Relince Fresh, Vikhroli (EMumbai-400 083.		
	Loan A/c. No.: ILAP12521 & ILAP13180 CRN No.37063960	Demand Notice Date: 31.12.2020 ₹ 77,87,202.33 (Rs. Seventy Seven Lakh	Mortgage over following propert :- B 202- Siddhivinayak Garden CHS		

Mrs. Rashmi Sandeep Mahale (Borrower) Eighty Seven Thousand Two Hundred Two & Ltd., Shiv Vallabh Road, Dahisar (East)

Thirty Three Paisa Only) as on 21.12.2020 Nr. Hanuman Mandir, off Bank of India. Mumbai-400 068 Demand Notice Date: 31.12.2020 ₹ Mortgage over following property : 1,24,04,452.71 (Rs. One Crore Twenty Four Flat No. 2004, 20th Flr., D wing Rahej

Heights Off General Arun Kumar Vaidva

Mortgage over following property :

Fifty Two and Seventy One Paisa only) as Marg, Ahead of Dindoshi Bus Depot, Mrs. Satyabhama Dagdu Karande (Co-Borrower) on 31.12.2020 Malad (E), Mumbai-400 097 More particularly mentioned in Agreement dated 17th August 2011, bearing Document Number 7366/2011.

Demand Notice Date : 08.01.2021 ₹

Lakhs Four Thousand Four Hundred and

Flat No. 305, B wing Dev Dasht Building 32,49,928.01 (Rs. Thirty Two Lakhs Forty Nine Thousand Nine Hundred and Twenty 60 feet Road, Bhayander (West), Mira Mrs. Krinali Suken Vohra (Co-Borrower) | Eight and One Paisa only) as on 29.12.2020 | Bhayander, Thane-401 101. f the said Borrowers shall fail to make payment to KMBL as aforesaid, KMBL shall proceed against the above secured assets unde Section 13(4) of the Act and the applicable Rules, entirely at the risks of the said Borrowers as to the costs and consequences. The said

Borrowers are prohibited under the Act from transferring the aforesaid assets, whether by way of sale, lease or otherwise without the prior written consent of KMBL. Any person who contravenes or abets contravention of the provisions of the said Act or Rules made there under, shall be liable for imprisonment and/or penalty as provided under the Act. Sd/- Authorized Officer For Kotak Mahindra Bank Limited Date : 20.01.2021

(પ્રતિનિધિ) મોડાસા,

સાબરકાંઠા અને અરવલ્લી

જિલ્લાના દૂધ ઉત્પાદકોને માટે

૩૦,૧૧,૪૫૬ કિલો ગ્રામ દૂધનું

સંપાદન કરવામાં આવ્યું છે. સાથે સાથે ગુજરાત રાજય બહારના રાજયોમાંથી પણ ૭,૦૧,૬૦૦ કિલો ગ્રામ દુધ સંપાદન કરી સાબરડેરીની

વિકાસયાત્રાનું નવું સોપાન સર કરી એક જ દિવસનું ૩૭ લાખ કિલો ગ્રામથી પણ વધુ દુધ સંપાદન કરી બંને જીલ્લાની જીવાદોરી એવી

સાબરડેરી માટે ગૌરવરૂપ

આજના મોંઘવારીના જમાનામાં

સીમાચિન્હ હાંસલ કરેલ છે.

વલસાડ બિલ્ડર એસોસિએશનની મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઈ



વિરપુર તાલુકા માટે આનંદનો સુર્ય...

રામપુરા ગામે કિસાન સુર્યોદય યોજનાનો

શુભારંભ કરાવતા સાસંદ રતનસિંહ રાઠોડ

(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ ડીસ્ટ્રીક બિલ્ડર એસોસિએશન દ્વારા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ. ર્જ મીટીંગ વલસાડ જીલ્લાના પ્રમુખ હેમંત કંસારાના માર્ગદર્શન હેઠળ, વલસાડના પ્રભારી મંત્રી કુમારભાઈ કાનાણીની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ. જેમાં વલસાડ જીલ્લા ભાજપના સંગઠનના હોદ્દેદારો શ્રી રાજેશભાઈ ભાનુશાલી (કોષાધ્યક્ષ), હાર્દિકભાઈ શાહ્ રાજે શભાઈ (ઉપપ્રમુખ)ના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં વલસાડ ડીસ્ટ્રીક

બિલ્ડર એસોસિએશનના પ્રમુખ શ્રી

અશોકભાઈ મંગે, સેક્રેટરી શ્રી

(પ્રતિનિધિ) વિરપુર,

કિસાનો માટે વિજ ક્રાંતિ

લાવનાર ઐતિહાસિક કિસાન

સુર્યોદય યોજનાના બીજા ચરણ

હેંઠળ પંચમહાલ સાસંદ રતનસિંહ

રાઠોડ હસ્તે વિરપુર તાલુકાના

રામપુરા ગામેથી આ યોજનાનો

શુભારંભ કરાવ્યો હતો સાસંદ

રૂતનિસિંહ રાઠોડે જણાવ્યું હતું કે વિરા બારીયાની વિર ભુમી પર વિજળી આવે તો સમાચાર બનતા

હતા અને વિજળી જાય ત્યારે પણ

સમાચાર બુનતા હતા હવે ખેડુતોને

કિસાન સૂર્યોદય યોજનાના લાભથી

ખેડુતને ×ેરાત્રે વિશ્રામ અને દિવસે

કામ× રાત્રી દરમ્યાન ખેડુતોને

શિયાળા- ચોમાસામાં ભારે તકલીફો

જંતુઓ અને જાનવરોના હુમલાઓ

રાજય સરકાર દ્વારા ૨૦૧૨ની

વિધાનસભા ચૂંટણી પહેલા

જનભાગીદારી યોજના જાહેર કરવામાં

આવી હતી. ખાનગી સોસાયટીઓમાં

આર.સી.સી. રોડ, ડ્રેનેજ લાઈન,

પાણીના નેટવર્ક તથા સ્ટ્રીટ લાઈટના કામ

જનભાગીદારી યોજના અંતર્ગત કરવામાં

આવી રહયા છે. સદ્દર યોજનામાં રાજય

સરકાર તરફથી ૭૦ ટેકા રકમ આપવામાં

આવે છે. જયારે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા

૧૦ ટકા અને ૨૦ ટકા ૨કમ લોકફાળાની

રહે છે. જન ભાગીદારી યોજનામાં

ફેબ્રુઆરી- ૨૦૨૦ સુધી આઠ હજાર કરતા

વધું કામ પુર્ણ કરવામાં આવ્યા છે. જયારે

_રપદ જેટલા કામ પ્રગતિ હેઠળ છે. કોરોના

અને લોકડાઉનના કારણે સરકારની

આવક ઉપર પણ મોટી અસર થઈ છે તેથી

રાજય સરકારે ૭૦ ટકા રકમના બદલે

સોસાયટીમાં પરિવાર દીઠ રૂા.રપ હજાર

ફાળો આપવા જાહેરાત કરી હતી. પરંતુ

સરકારની જાહેરાત બાદ મનપાના બજેટ

અને જાહેરાત પર મોટી અસર થાય તેવી

શકયતા લાગતાં સરકારે જૂની યોજના મુજબ નાણાં ફાળવવા નિર્ણય કર્યો છે.

છેલ્લા રીપોર્ટ મુજબ પ**૦૮** કરતા વધુ

સોસાયટીઓમાં તથા સ્ટ્રીટલાઈટ

વિભાગનાં ૯૯ કામ માટે રૂા.૭૧

કરોડની માંગણી સરકાર સમક્ષ કરવામાં

આવી છે. જયારે સદર યોજના અંતર્ગત

સરકાર પાસે ૧૫૦ કરોડ લેવાનાં બાકી

રહેતાં હોવાની વિગતો બહાર આવી છે.

વર્ષ પહેલાં ૯૧ ૩ સોસાયટીના બાકી કામ

ञोन

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને એક

સોસાયટીની

તાલુકા બિલ્ડર એસોસિએશનના પ્રમુખ બીપીનભાઈ બાવાભાઈ પટેંલ, વાપીથી મનસુખભાઈ રોજીવાડીયા હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ વલસાડથી પધારેલ સર્વે સંગઠન પદાધિકારીઓ અને એસોસીએશનના સભ્યોને ખુબજ ઉષ્માપૂર્વક આવકાર્યા હતા અને વલાસંડ જીલ્લામાં બાંધકામ ઉદ્યોગને લગતા પ્રશ્નોની ચર્ચા શરુ કરી હતી.

જેમાં એસોસીએશન તરફે નગરપાલિકાની આજુબાજુમાં સેન્સેકસટાઉને PMAY સબસીડી લાભ મળે. જીલ્લામાં થયેલ ખોટું પ્રમોલગેશન મોકૂફ રહે. જીલ્લામાં DELR.SLR, સીટી સર્વે ચેતનભાઈ ભાનુશાલી, વલસાડ કચેરીઓમાં સુપ્રિન્ટેન્ડેન્ટ, કાયમી

રહે તે માટે ક્રાતીકારી કિસાન

સુર્યોદય યોજના લાગુ કરવાનો

મહાનુભાવો જેવાકે પંચમહાલ

સાસંદ રતનસિંહ રાઠોડ,અંશ

નાગરિક પુરવઠા નિગમ પુર્વ ચેરમેન

રાજેશ પાઠક,ગંધારી? ગ્રામ પંચાયત

સરપંચ એસ બી ખાંટ, જીલ્લા પંચાયત પુર્વ પ્રમુખ મંજુલાબેન ખાંટ, મહિસાગર જીલ્લા કલેકટર

આર બી બારડ, ડીડીઓ,

એ મજીવીસીએલ કાર્યપાલક

ઇજનેર આર જી શાહ,પુર્વ

મ્યુનિ. કોર્પોરેશને જનભાગીદારી ચોજના અંતર્ગત ૫૦૮

સોસાયટીના કામ માટે રૂા. હ૧ કરોડની માંગણી કરી

७०:२०:१० ચોજના પેટે સરકાર પાસેથી રૂા.૧૫૦ કરોડ લેવાના બાકી

આપ્યુ હતુ જેમાં બાકી કામ પેટે

રૂા.૭૪.૭૫ કરોડની માંગણી કરવામાં

આવી હતી. એક વર્ષ બાદ પણ

પરિસ્થિતિમાં કોઈ મોટો ફરક પડયો નથી.

કરવામાં આવેલ છેલ્લી યાદી મજબ

રૂા.૯૨૬ કરોડના કામ કરવાનાં થાય છે.

જૈના ૭૦ ટકા લેખે રૂા.૬૪૮ કરોડ

સરકાર પાસેથી લેવાના થોય છે જેની સામે

સરકાર દ્વારા રૂા.૫૦૯.૪૫ કરોડ

આપવામાં આવ્યા છે. જયારે ૪૮૨

સોસાયટીના બાકી કામ પેટે રૂા.૭૧

કરોડની ગ્રાન્ટ લેવાની રહેં છે.

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આ અંગેની

તમામ માહિતી રાજ્ય સરકારને

મોકલવામાં આવી છે. પરંતુ હજી સુધી

સરકાર તરફથી ગ્રાન્ટપેટે કોઈપણ

રકમ મળી નથી. મ્યુનિ. કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ

સરકાર દ્વારા જનભાગીદારી યોજના

પેટે કોઈ જ રકમ ફાળવવામાં આવી

નથી. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તમામ

ખર્ચ કરવામાં આવ્યો છે જેના ૭૦ ટકા

લેખે સરકાર પાસેથી રૂા.૧૫૦ કરોડ

અલગથી લેવાના બાકી નીકળે છે.

૨૦૧૨-૧૩માં વિધાનસભા ચૂંટણી

સમયે રાજય સરકાર દ્વારા

કરવામાં આવી હતી. તે સમયે

રૂા.૨૦૦ કરોડ ફાળવ્યા હતા.

૨૦૧૩-૧૪માં રૂા.૯૬.૫૮ કરોડ

અને ૨૦૧૪-૧૫માં રૂા.૧.૭૦

કરોડની ગ્રાન્ટ આપી હતી. ૨૦૧૫-

પૂર્ણ થયેલ|ચાલુ કામોની

(પ્રતિનિધિ) અમદાવાદ, માટે લીસ્ટ તૈયાર કરી સરકારને મોકલી

આ કાર્યક્રમમાં ઉપસ્થિત

નિર્ણય કર્યો.

ટાઉનપ્લાનર, ફાયર ઓફિસર, વલસાડની નિમણુંક તથા વાપી નગરપાલિકાને લાગુ ગામોમાં એરિયા ઓથોરીટી બનાવવી તથા અનેક મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેનો માનનીય મુખ્યમંત્રી દ્વારા હકારાત્મક પ્રતિસાદ મળતાં બિલ્ડરોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

વલસાડ અને વાપી નગરપાલિકાને લાગુ ગામોમાં એરિયા ઓથોરીટી માટે જરૂરી કार्यवाહी કरवा माटे क्लेक्टर વલસાડને પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે. વલસાડ અને ઉમરગામની ડીપી ની કાર્યવાહી પણ ઝડપથી પૂર્ણ થશે. આમ વલસાડ જીલ્લાનો વિકાસ ઝડપી અને સુચારુ થાય એવા સરકારશ્રીના, ભાજપ સંગઠન અને વલસાડ ડીસ્ટ્રીક સંગઠન અને વલસાડ ડાસ્ટ્રાક એસોસિએશનનો સુંદર પ્રયાસ રહ્યો છે. આ પ્રયાસ માટે મુખ્યમંત્રી વિજય રુપાણી સાહેબ અને પ્રભારી મંત્રી કુમાર કાનાણી સાહેબ ખુબજ અભિભૂત થયા હતા. અને આ સિવાય પણ જે કાઈ પ્રશ્રો હશે એનું નીરાકરણ કરવા માટે સરકાર તરફે સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ

સબરડેરીનું એક જ દિવસનું વિક્રમજનક ૩૦,૧૧,૪૫૬ કિલોગ્રામ દૂધ સંપાદન કરાયું: એમ.ડી.બાબુભાઇ પટેલ

આ સફળતાનો ચશ ત્રણ લાખ દૂધ ઉત્પાદકોને જાય છે:ચેરમેન શામળભાઈ પટેલ અને નિચામક મંડળ

જીવાદોરી સમાન સાબરડેરીએ ગઈકાલે એક જ દિવસમાં અત્યાર મહત્વનું યોગદાન પુરુ પાડી સુધીમાં દુધનું વિકમજનક ૩૦,૧૧,૪૫૬ કિલોગ્રામ દૂધ સ્વમાનભેર જીવન, સ્વરોજગારી અને નિયમિત આવકનો સ્ત્રોત સંપાદન કરાયું હતું. બજો જિલ્લાઓનાં દૂધ ઉત્પાદકોને સાબરડેરી તરફથી મળતા સતત સાબિત થયેલ છે ત્યારે દુધ ઉત્પાદકોના પશુપાલન વ્યવસાયમાં ઉતરોત્તર વધેલા વિશ્વાસ,સંઘની દૂધના ઉચા પોષણક્ષમ ભાવો, દુધ વ્યવસાયમાં વધુ વળતર અને પશુપાલન્ વ્યવસાય માટેની સભાસદલક્ષી વિવિધ સહાયકારી યોજનાઓ તથા ક્ષતિરહિત ઈનપુટ સેવાઓના પરિણામે આજે દૂધનું વિક્રમજનક સંપાદન થઈ રહયુ છે. સાબરડેરીની આ ઉપલબ્ધિ ક્ષણે પ્રોત્સાહક નિતીને પરિણામે તા.૧૯ જાન્યુઆરી,૨૦૧૧ ના રોજ સાબરડેરીના ઈતિહાસમાં સૌથી વધુ

સંઘના મેનેજીંગ ડીરેકટર.બાબુભાઈ

સામાજિક અને આર્થિક વિકાસમાં પટેલે આ સફળતાનો યશ ૩ લાખથી વધુ દુધ ઉત્પાદકોને આપ્યો હતો અને ચેરમેનશ્રી શામળભાઈ પટેલ અને નિયામક મંડળના સતત મળતા માર્ગદર્શન, સહકાર અને પ્રેરણા તથા સાબરડેરીના કર્મનિષ્ઠ કર્મચારીઓના સતત પ્રયાસોને આભારી હોવાનું જણાવી હજુ પણ દુધ ઉત્પાદકો નવાં દુધાળા પશુઓ વસાવી વધુ આવક મેળવે તે માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે તેઓ એ હજુપણ દુધમાં વધારો થવાનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. ★



પાલનપુર હિન્દૂ સમાજ સંચાલીત માનસરોવર પાસે આવેલા અંતિમધામનો વિકાસ થઈ રહયો છે.આ અંતિમધામમાં ઈલેક્ટ્રીક ળ્લોઅરની સુવિદ્યા ઉમેરી શરૂઆત કરવામાં આવી છે.અંતિમધામમાં મૃતદેહના અગ્નિસંસ્કારમાટેબારથી પંદરમણલાકડાનો ઉપયોગથતો હતો હવે ઈલેક્ટ્રીક બ્લોઅરની સુવિધા થતાલાકડાની બચત થશે તેમજ અગ્નિ સંસ્કાર વિધિ એકથી દોઢ કલાકમાં વિધિ પૂર્ણ થઈ જશે.

(તસ્વીર:ભગવાન સોની,પાલનપૂર)

જમ્મુ કાશ્મીરમાં ચાર ધૂષણખોરોને ઠાર મરાચા

જમ્મુ કાશ્મીરના જમ્મુ જીલ્લામાં નિયંત્રણ રેખા પર ચાર ધુષણખોરોને સેનાએ ઠાર માર્યો છે. આ દરમિયાન ચાર સૈન્ય કર્મચારી પણ ઘાયલ થયા છે. સેનાએ ધુષણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે રક્ષા સુત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાની ર્સેનાએ આંતકવાદીઓની ધૂષણખોરીને સરળ બનાવવા માટે એલઓસીના અખનુર સેકટરના ખૌર ક્ષેત્રમાં ભારે ગોળીબાર કર્યો હતો પાકિસ્તાની ગોળીબારમાં સેના ચાર જવાનોને ઇજા થઇ હતી આ દરમિયાન ભારતીય સેનાની કાર્યવાહીમાં ચાર આતંકીઓ મરાયા હતાં આ સાથે જ ધુષણખોરીને નિષ્ફળ કરવામાં આવી હતી સુત્રોના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા આતંકવાદીઓના શબ એલઓસીના પાકિસ્તાન તરફ પડયા છે અને તેને ત્યાર સુધી પાકિસ્તાની સૈનિકોએ ઉઠાવ્યા નથી આ ૨૦૨૧માં એલ્ઓસી પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ પહેલું મોટો સંધર્ષ વિરામનો ભંગ છે.જયારે અન્ય વિસ્તારમાં તે ભંગ કરી રહ્યું છે.

રૂપાણી અને કુંમાર કાનાણી સાહેબે ખાતરી આપી હતી. ★ પશુપાલન અને દુધ વ્યવસાય બંને જિલ્લાના ગ્રામીણ પરિવારો ના ભારતે કોરોનાની વેકસીનનો

પ્રથમ જથ્થો ભુતાન રવાના કર્યો નવીદિલ્હી,

ભારતે કેટલાક દિવસ પહેલા જાહેરાત કરી હતી કે તે પોતાના મિત્ર દેશોને ભેટ તરીકે કોરોનાની વેકસીન આપશે.ત્યારે આજે ભારતે તે વચન પુરૂ કર્યું છે આજથી ભારતે ભુતાન માલદીવ બાંગ્લાદેશ નેપાળ મ્યામાંર અને સેશેલ્સને વેકસીનનો પુરવઠો શરૂ કર્યો છે.

સૌથી પહેલા ભુતાનને કોરોના વેકસીન કોવિશીલ્ડના દોઢ લાખ ડોસેજ મોકલ્યા છે.સીરમ ઇસ્ટીટયુટની આ વેકસીન મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાની મથકેથી ભુતાન માટે થિમ્પુ હવાઇ મથક માટે આજે સવારે રવાનો થયો હતો

આમ ભુતાન પહેલો એવો દેશ બુની ગયો છે જેને ભારત તરફથી ભેટમાં કોરોના વેકસીનનો પહેલો પુરવઠો મળશે આ રીતે ભુતાન ઉપરાંત બીજા પડોસી દેશોને પણ ભારત તરફથી વેકસીન ઉપલબ્ધ કરાવવામાં આવશે વિદેશ મંત્રાલયે આ વાતની માહિતી આપી હતી કે ભારતને અનેક પડોસી દેશોથી ભારત નિર્મિત કોરોના વેકસીનના પુરવઠા માટે વિનંતી આવી હતી.

૧૬માં મ્યુનિ.કોર્પોરેશનની ચુંટણી

હોવા છતાં રાતીપાઈ પણ ફાળવવામાં

આવી ન હતી. ૨૦૧૬-૧૭માં

સરકારે રૂા.૧૦૫ કરોડ આપ્યા હતા.

૨૦૧૭-૧૮માં સરકારે કોઈ રકમ

રૂા.૩૮ કરોડ આપ્યા હતા. ૨૦૧૯-

રં૦માં કોઈ જ રકમ આપી ન હતી.

૨૦૨૦-૨૧માં સરકાર હજી સુધી

રકમ ફાળવી નથી. ઑમ

મ્યુનિ.કમિશનરના ડ્રાફ્ટ બજેટમાં

જનભાગીદારી યોજેના અંતર્ગત

રૂા.૧૫૦ કરોડની ગ્રાન્ટ દર્શાવવામાં

આવી છે. નોંધનીય બાબત એ છે કે

૨૦૧૯-૨૦માં પણ જનભાગીદારી

યોજના હેઠળ રૂા.૬૮ કરોડ મળવાની

અપેક્ષા હતી. જે રીવાઈઝ્ડ કરી

રૂા.૫૦ કરોડ કરવામાં આવી હતી.

પરંતુ સરકાર તરફથી કોઈ જ રકમ

મળી નહતી. સ્વર્ણિમ જયંતી

મુખ્યમંત્રી યોજના અંતર્ગત ૨૦૧૨માં

જનભાગીદારી યોજના અંતર્ગત

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જે ૫૦૮

સોસાયટીના કામ કરવાના છે તેની

વિગત સરકારને આપવામાં આવી છે.

જે પૈકી ૪૪ સોસાયટીનાં કામ પૂરા

થયાં છે, પૂર્વઝોનની ૬ સોસાયટીનાં

સોસાયટીનાં કામ પૂર્ણ થયાં છે, ૩૦

સોસાયટીનાં કામ પેન્ડીંગ છે જ્યારે

૨૩૨ સોસાયટીઓમાં કામ ચાલી

રહ્યાં છે. ૬૦૭ સોસાયટી પૈકી ૯૯

રદ કામોની

४८२

કામ સ્ટ્રીટ લાઈટ વિભાગનાં છે.

પેન્ડીંગ

કરવામાં આવેલી

વિદેશ મંત્રાલયના જણાવ્યા ધારાસભ્ય માનસિંહ અનુસાર શ્રીલંકા અફઘાનિસ્તાન ચૌહાણ,જીલ્લા માહમંત્રી જયેન્દ્ર મોરીશસના સંબંધમાં આવશ્યકત બારોટ, વિરપુર તાલુકા વિકાસ નિયામક મંજુરીની રાહ જોવાઇ રહી પડી રહી હતી ઉપરાંત ઝેરી જીવ અધિકારી, મામલતદાર સહિતના છે વિદેશ મંત્રાલયે કહ્યું કે કારણ કે દેશમાં પણ રસીકરણનો કાર્યક્રમ આગેવાનોની ઉપસ્થિતિમાં ડર્સતાવી રહ્યો હતો જેના ભાગરૂપે કિસાન સુર્યોદય યો જનાનો જારી છે આથી એ વાતનું ધ્યાન સંવેદનશીલ સરકાર પિયત મોટે શુભારંભ કરવામાં આવ્યો રાખવામાં આવશે કે વિદેશમાં ખેડૂતોને દિવસે વીજપુરવઠો મળી 🛚 હતો. 🛨

મ્યુનિ. ઈજનેર ખાતા દ્વારા અપડેટ આપી નહતી. ૨૦૧૮-૧૯માં

જનભાગીદારી યોજના જાહેર કામ રદ કરવામાં આવ્યાં છે, ૯૩

અંદાજ


પુરવઠો કરતી વખતે ઘરેલુ આવશ્યક્તાઓને પુરા કરવા માટે યોગ્ય સ્ટોક હો.

ભારત અને ભુતાન વચ્ચે સંબંધ ખાસ છે તેને ધ્યાનમાં રાખી ભારતે કોરોનાના કારણે લાગેલ લોકડાઉનમાં દરેક જરૂરી સામગ્રીનો પુરવ્ઠાને સુનિશ્ચિત કરવામાં આવ્યો હતો ભારતે અત્યાર સુધી ભુતાનને લગભગ ૨.૮ કરોડ રૂપિયાથી વધુની કીમતની જરૂરી દ્વાઓ મેડિકલ પુરવઠો પોરાસિટામોલ હાઇડ્રોકસીકલોકવીન પીપીઇ કિટ

એન૯૫ માસ્ક એકસરે અને ટેસ્ટ

કિટ ઉપલબ્ધ કરાવી હતી.

બે મહીનાથી ગુમ જેક મા અચાનક દુનિયાની સામે પ્રગટ થયા



સમૂહના માલિક જૈક મા અચાનકથી દુનિયાની સામે પ્રગટ થઇ ગયા છે તાજેતરમાં જૈક મા એક વીડિયો કોન્ફરન્સમાં નજરે પડયા હતાં. દુનિયામાં વધતા દબાણ બાદ ગ્લોબલ ટાઇમ્સે જૈક માનો આ વીડિયો જારી કર્યો છે.

અખબારના જણાવ્યા અનુસાર જૈક માએ બુધવારે ચીનના ૧૦૦ ગ્રામીણ શિક્ષકોની સાથે વીડિયો લિંક દ્વારા સંવાદ કર્યો છે જૈક માએ શિક્ષકોને કહ્યું જયારે કોરોના વાયરસ ખતમ થઇ જશે તો આપણે ફરી મળીશું ગ્લોબલ ટાઇમ્સો જૈકમાને ઇગ્લિશ ટીચરને ઉદ્યમી બનાવનારા ગણાવ્યા જૈકમાના પરિચયમાં અલીબાબાનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો જેની સ્થાપના ખુદ તેમણે કરી હતી.ચીનમાં અફવાઓનું બજાર

બ્લુ ચિપ ટેક્સ

एन्डस्ट्री असिटेड

CIN : L17100DN1985PLC005561 રજી ઓફિસ : પ્લોટ નં. દ ૩-બી, દાનુયુગ સંસ્કારી સંઘ લી. ગામ પીપરીયા, સીલવાસા, દાદરા અને નગર હવેલી -૩૯૬૨૩૦

કાંઠરા અને નગર હવેલા-ઉલ્ટર ૨૩૦ કમેંઘલ : bluechiptex@gmail.com ન નં.૯૧-૯૯૨૪૪૨૨૨૪૭ /૯૧-૨૨-૪૩૫૩૦૪૦

नोटीस

ીસ્કોલઝર રીકવાયરમેન્ટ)ના

<mark>ગ્યુલેશન ૨૯ અને નિયમન ૪૭</mark>

નુસાર નોટીસ આપવામાં આવે છેકે

<mark>પનીના બોર્ડ ઓફ ડીરેકટર્સની બેઠક</mark>

વેડીયો કોન્ફરન્સિંગ દ્વારા શુક્રવારે

ર૯મી જાન્યુઆરી ૨૦૨૧ના રોજ

બપોરે ૩ઃ૦૦ વાગ્યે યોજાશે જેમા ૩૧

ડીસેમ્બર ૨૦૨૦ના રોજ પુરા થતા<mark>)</mark>

ત્રીમાસીક અનઓડીટેડ નાંણાકીય

હેસાબોને મંજૂર કરવા અને ધ્યાને

og ચિપ ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડવતી

<mark>ાધુ માહિતી માટે કૃપા કરીને આની મુલાકાત</mark>

શાહિન .એન. ખેમાની

સેબી (લીસ્ટીંગ ઓબ્લીગેશન અને



ગરમ છે કે જૈકમાની કંપી અલીબાબાનું નિયંત્રણ ચીન સરકાર પોતાના હાથમાં લઇ શકે છે.

હકીકતમાં જૈક માએ ગત ઓકટોબરમાં કોઇ મુદ્દા પર ચીની સરકારની ટીકા કરી હતી જૈકમાએ સરકારને આહ્વાન કર્યું હતું કે તે⁻ એવી સિસ્ટમમાં પરિવર્તન કરે જે કારોબારમાં નવાચારોના પ્રયાસોને મિસેર્સ યુ પી એલ્ લિમિટેડના Amit Operoji (શે દબાવવાનું કામ કરે છે માના આ ભાષણ બાદ ચીનની સત્તારૂઢ

કમ્યુનિસ્ટ પાર્ટી મા પર બગડી ગઇ હતી ત્યારબાદ જૈક માના એટ ગ્રુપ સહિત અનેક કારોબાર પર અસાધારણ પ્રતિબંધ લગાવવાનું

શરૂ થઇ ગયું હતું. મીડિયા પ્રત્યે ખુબ જ સહજ રહેનારા જેક માનું એટ ગ્રુપનું આઇપીઓમાંથી નિલંબન બાદથી તેઓ કોઇ જ જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા ન હતાં આથી તમામ ચોંકી ઉઠયા હતાં એ યાદ રહે કે ૨૦૧૬ અને ૨૦૧૭માં ચીનના કુખ્યાત ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન દરમિયાન અનેક અરબપતિ ગુમ થઇ ગયા હતા તેમાંથી કેટલાક ફરી જોવા મળ્યા હતાં તેમણે કહ્યુ કે તે અધિકારીઓની મદદ કરી રહ્યાં હતાં જયારે અન્ય કયારેય પાછા

હોલ્ડર નું નામ) ને નામે રહેલા 200 ઈકવીટી શેરો સટફિક્ટ નંબર 181895 અને ડિસ્ટિક્ટીવ નંબર 55386290 થી 55386489 સ્ટિફિકેટ ખોવાય્ /ગુમ થયા છે અને તેથી કંપનીને આ શેરો મા -લીકેટ સર્ટ્યફ્રીફેટ ઈસ્યુ કરવા માટ્રેની અરજી મળી કાઈપણ વ્યક્તિને ઉપરાંક શિરોની બાબતે દાવો હોય તો તેને કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ ૩-૧૧ જિ.આઇ.ડી સી, વાપી ગુજરાત-396195 ખાતે આ નાટિસની પ્રસિધિની તારીખથી ૧૫ દિવસમાં દાવો નોંધાયો નહીં તો કંપનીની કોઈ પણ વધુ જાણ કર્યા સિવાય ડુપ્લીકેટ સર્ટીફીકેટ ઈસ્યું કરવાન

નો.ટિસ

જાહેરાતો અંગે વાંચકોએ પોતાની રીતે ચકાસણી કરી નિર્ણય લેવો.

લેસ્ટર્ન ટાઇમ્સ

વેસ્ટર્ન ટાઇમ્સમાં પ્રકાશિત

-જાહેરખબર મેનેજર

કાર્યવાહી કરશે. શેરહોલ્ડર નું નામ Mr Amit Oberoi તારીખ : 21/01/2021 Folio no R07851



યુપીએલ લિમિટેડ

નોંધણીકૃત કાર્યાલયઃ ૩–૧૧, જી.આઈ.ડી.સી., વાપી, જિલ્લો વલસાડ, ગુજરાત – ૩૯૬ ૧૯૫. વેબસાઈટઃ www.upl-ltd.com | ઈ-મેઈલઃupl.investors@upl-ltd.com | ફોન નંઃ +૯૧ ૨૬૦ ૨૪૩૨૭૧૬ નોટિસ

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા (લિસ્ટિંગ ઓબ્લિગેશન એન્ડ ડિસ્કલોઝર रिडपायरभेन्ट्स) रेग्युलेशनस,२०१५ना नियमन २८ साथै पायता नियमन ४७(१) (એ) અન્વચે નોટિસ આપવામાં આવે છે કે કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટરોની મિટિંગ શુક્રવાર, ૨૯મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ સુનિશ્વિત થયેલ છે, જેમાં અન્ય બાબતો ઉપરાંત,૩૧મી ડિસેમ્બર,૨૦૨૦ નાપૂરા થચેલાં ત્રિમાસિક અને નવ મહિનાના સ્ટેન્ડઅલોન અને કોન્સોલિકેટેક નાણાંકીય પરિણામો રેકોર્ડ પર લેવાશે, અને લિમિટેક રીવ્યુ રીપોર્ટસ સ્ટેન્ડઅલોન અને કોન્સોલિકેટેડ નાણાંકીય પરિણામા માટે મેસર્સ બી એસ આર એન્ડ કં. એલ એલ પી, ચાર્ટર્ક એકાઉન્ટન્ટ્સ, કંપનીના સ્ટેચ્યુટરી ઓડીટર દ્વારા જારી રીપોર્ટસ

આ માહિતી કંપનીની વેબસાઈટ https://www.upl-ltd.com પર પણ આપવામાં આવી છેઅને બીએસઈ લિમીટેડ ની વેબસાઈટ www.bseindia.com અને નેશનલ સ્ટોક એક્સચન્જ ઓક ઈન્ડીયા લિમિટેડ ની વેબસાઈટ www.nseindia.com પર પણ જોઈ શકાશે

> યુપીએલ લિમિટેડ વતી સંદિપ દેશમુખ કંપની સેક્રેટરી અને

કોમ્પ્લાયન્સ ઓકિસર ર ૨૦મી જાન્યુઆરી,૨૦૨૧



સે<mark>વામા આવશે.</mark>

AHMEDABAD MUNICIPAL CORPORATION S.T.P. DEPARTMENT

E-SHORT TENDER NOTICE NO: 64 / 2020-2021 Supply of HT Panel and Transformer of different size for Various sewage and storm water

pumping station of AMC.			
Last Date of Submission (on-line)	Date: 02.02.2021 upto 18.00 Hrs.		
Last Date of Submission of (Hard copy)	Date: 03.02.2021 upto 16.00 Hrs.		
Tender Opening time & date of	Date: 03.02.2021 upto 17.00 Hrs.		
(Technical bid)			
Details and Tenders Available on	www.nprocure.com		



વિરપૂરનગરમાં જૂની સર્કીટ હાઉસ કેટલાક વર્ષોથી ખંડેરઅને જર્જરિત હાલતમાં જોવા મળ્યું છે તેમ છતાં તંત્ર દ્વારા તેને કોઈ પણ પ્રકારની સાવચેતી કે કામગીરી કરવામાં ના આવતી સ્થાનિક પ્રજામાં રોષની લાગણી ફેલાઈ છે સર્કીટ હાઉસ ચારે બાજુમાં સીમેન્ટની સુરક્ષા બોર્ડર કરવામાં આવી છે જેથી કરીને અંદર પ્રવેશ કરી શકે નહીં તેમ છતાં વાહન પાર્કિંગ કરી રહ્યા છે સર્કીટ હાઉસ એટલી હદે જોખમી તેમજ જર્જરિત હાલતમાં છે જેનો આગળનો પ્રવેશ દ્ગવા ર તેમજ એક હીસ્સો ટુટી અને હાડપિંજરની જેમલબડી રહ્યો છેઓ જગ્યાએ જાહેરચેતવણી નુસાઈન બોર્ડ પણ ઉભું કરવામાં આવ્યું છે તેમ છતાં સ્થાનિક લોકો આ જગ્યાને પોતાનું વાહન પાર્કિંગ કરી પાર્કિંગ ઝોન તરીકે ઉપયોગ શરૂ કરી દીધો છે તેમજ સર્કીટ હાઉસ જગ્યા પર અસામાજીક તત્વો દ્વારા જુગારધામ તેમજ ખોટી પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે.

(તસ્વીર:-પૂનમ પગી , વિરપુર)

દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી અને ધુમ્મસથી રાહત મળશે નહીં ના અંદાજ લગાવી શકાય છે કે

દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત ઠંડીની ચપેટમાં છે આમ તો છેલ્લા કેટલાક સમયથી કયારેક ધુમ્મસ તો કયારેક શીતલહરનો લોકો સામનો કરી રહ્યાં છે પરંતુ હવામાન વિભાગનું માનવામાં આવેતો આસ્થિત આગામી બે ત્રણ દિવસ જારી રહેશે આ સાથે જ મૌસમ શુશ્ક રહેશે અને સામાન્ય વરસાદની પણ સંભાવના છે દિલ્હીમાં આજનું તાપમાન ૯.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયુહતું ધુમ્મસની ચાદર વચ્ચે માર્ગ કિનારે રહેનારા લોકો આગ તાપી ઠંડીથી બચતા નજરે પડી રહ્યાં હતાં.

જયારે રાજસ્થાનમાં રાતમાં ન્યુનતમ તાપમાનમાં વધારો નોંધાયો હરિયાણામાં ધુમ્મસ છવાયેલુ રહ્યું હતું પંજાબના લુધિયાણા અને ભાઠિંડામાં તાપમાન ૭ ડિગ્રી રહ્યું શ્રીનગરનો પારો શૂન્યથી ૭ ડિગ્રી ઓછો રહ્યો કાશ્મીરમાં અનેક જગ્યાએ તાપમાન શૂન્યથી નીચે રહ્યું

આવનારા દિવસોમાં ઠંડીથી રાહત મળનાર નથી મૌસમ વિભાગના જણાવ્યા અનુસાર ૨૨ જન્યુઆરી સુધી પંજાબ હરિયાણા રાજસ્થાન યુપી અને ઉત્તરાખંડમાં ગાઢ ધુમ્મસ અને શીત લહેરનો કહેર રહેશે જયારે બિહાર અને ઉત્તરપ્રદેશ ગાઢ ધુમ્મસનો સામનો કરશે જયારે નોર્થ ઇસ્ટમાં પણ સામાન્ય વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે જયારે ઉત્તરાખંડમાં ૨૩ જાન્યુઆીએ અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના અને ઉપરી વિસ્તારમાં બરફવર્ષાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. દેશમાં કેલાક શહેરોમાં તાપમાન જોઇએ ત મુંબઇમાં ૨૦.૮ ડિગ્રી, નવીદિલ્હી ૯-.૮ ડિગ્રી, બેંગ્લુરૂ ૧૭,ચેન્નાઇ ૨૪.૨,હૈદરાબાદ ૧૮.૬ કોલકતા ૨૦.૬ અમદાવાદ ૧૫.૨ અને પુણેમાં ૧૮ ડિગ્રી સેલ્સિયસ



પાલનપુરખાતેમહારાણાપ્રતાપનેપૃષ્પાંજલીઅર્પણકરાઈકેલાશમાનસરોવર મુક્તિ આંદોલન સમિતિ બનાસકાંઠા જુલ્લાની ટીમ દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષમુકેશભાઈદરજી,ઉપાધ્યક્ષશ્રીમતિઉષાબેનજોષી,મંત્રીબાલકૃષ્ણ જુરાલા,શ્રીઅશોકભાઈપુરોહિત,શ્રીમતિજાગૃતિબેનમહેતા,અંકિતભાઈ મોદી , ફુલસિંહજી ડાભી , ઉત્તમભાઈ દરજી , કોંશલભાઈ જોવી , વિગેરેએ ભારતમાતાના નારા સાથે કુલહાર કરી પુષ્પાંજલી અર્પણ કરી હતી .

(તસ્વીરૅ:-ભગવાન સોની , પાલનપુર)

અહેરાત

પૃથ્વી એન્ટરપ્રાઈઝ - અમદાવાદ કંપની નીચે મુજબના ઉલ્લેખ કરેલા પાણીમાં સંપૂર્ણ પણે વિદ્રાવ્ય મિક્ષ ખાતરના ૧૦૦ ટકા Water Soluble Mixture of Fertilizer આયત અને ઉત્પાદન કરીને ગુજરાત રાજયમાં વેચાણ કરવાના છીએ. એન.પી. કે. ૧૯.૧૯.૧૯ એના.પી.કે. ૯-૦-૪૩ -એન.પી.કે. ૧૪-૪૮-૦ એન.પી.કે ૧૩-૪૦-૧૩ ઉપર ના ઉત્પાદનનો ગુણવત્તા, The Fertilizer (Control) order 1985 મુજબ Notification No. S.0.4120(E), Date : 30.12.2017 મુજબ રહેશે.

1411, Ph - 3, વટવા, જી.આઈ.ડી.સી., અમદાવાદ, (इोन नं. : ०७६ - २५८६१५४६)

SIHIOS બીટીસ હિલ્લુથીરિટાઇઝેશન એન્ડ રિકસ્ટ્રકશન ઓક ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્કોસેમેન્ટ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ ની કલમ ૧૩ (૨) હેઠળ (આ કાયદો) સિક્યુરિટી ઇન્ટરેસ્ટ (એન્કોસેમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ ના નિયમ (આ નિયમો) ૩(૧) સાથે વાંચવામાં આવ્યો છે. ઉપરોક્ત અધિનેયમની કલમ ૧૩(૧૨) હેઠળ આપવામાં આવેલ સત્તાઓના ઉપયોગમાં આ નિયમોના નિયમ ૩ ની સાથે વાંચતા, આઈઆઈએકએલ ગૃહ કાઇનાન્સ લિમેટેડ (IFL HFL) (અગાઉ ઇન્ટિયા ઇન્ટિયા ઇન્કોલાઇન હાઉસંગ કાઇનાન્સ લિમેટેડ)ના અધિકૃત અધિકારીએ જારી કર્યા છે. ઉપરોક્ત અધિનિયમની કલમ ૧૩ (૨) હેઠળ મોગણી નોટિસ, ઉધાર લેનારા (ઓ) ને, તેઓને સંબંધિત ડિમાન્ડ નોટિસ (ઓ)માં જુલાવેલ રક્ષ પરત કરવા માટે હાઠલ કરે છે. ઉપરના સંબંધમાં, કરીથી આ સૂચના પ્રકાશિત થયાની તારીખલી ૯૦ દિવસની એંદર લેલાદાર(ઓ)ને યુક્વણી કરવા માટે સૂચના આપવામાં આવે છે, ના વધુ વ્યાજ સાથે, નીચે જુલાવેલ ૨કમ, ઓ મોગણી સૂચના યુક્વણીતી તારીખ સુધી લેલાદાર (ઓ) ની વિગત, તારીખ મુજબની ૨કમ મોગની સૂચના અને લોનની ૨કમની યુકવણી માટે આપવામાં આવતી સુરક્ષા નીચે યુજબ છે:-

डीभान्ड नोटीस तारीण अने रङभ

સિક્યોર્ડ એસેટ (સ્થાઇ મિલ્કત)નું વર્ણન

દેવાદારો/ જમોનાદારોના નામો વસ્ત્રુપ્ત હતા કરિક ના કરિ

જાહેર નોટીસ

ફોર્મ નં. આઇએનસી-૨૬ કંપનીઝ (ઇકોર્પોરેશન્સરૂલ્સ - ૨૦૧૪ નીકલમ - ૩૦ અનુસાર)

કંપનીર જીસ્ટર્ડ ઓફીસ ગુજરાત રાજ્યથી મહારાષ્ટ્ર રાજ્યમાં સ્થળાંતર કંપનીઝ એકટ ૨૦૧૩, કંપનીઝ એકટ – ૨૦૧૩ ની કલમે - ૧૩(૪) અને કંપનીઝ (ઇક્રોપોરેશન) કલમ-૨૦૧૪ રૂલ્સ ૩૦ (૬) નીમેટરમાં

જીઆરવી જંકશન એગ્રિટેક્ટ પ્રાઇવેટ લીમીટેડ ની મેટરમા ધારણ કરનાર CIN: U01110GJ2020PTC112801 કંપની એક્ટ, ૨૦૧૩ હેઠળ કંપની રજીસ્ટર્ડ થયેલ છે અને તેની રજીસ્ટર્ડ ઓફીસ એફ-૫૦૧, અક્ષરધામ રેસીડેન્સી, માત્રુભુમી સોસાયટી પાસે, વસંત વિહાર સોસાયટી, નવા નીકોલ, અમદાવાદ ૩૮૨૩૫૦, ગુજરાત, ઇન્ડીયા મા ધરાવેછે.

અત્રે જાહેર જનતાને નોટીસ આપવામા આવે છે કે કપનીઝ એકટ, ૨૦૧૩ ની કલમ ૧૩ હેઠળ કપનીના મેમોરેન્ડમ ઓફ એસોસીએશન મા ફેરફાર ઇચ્છવુ હોય કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત ની અરજી કરવા ખાસ ઠરાવ પસારકરવા, ખાસ સામાન્ય સભા ૧૨ મી જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ તેની રજીસ્ટર્ડ ઓફીસ ગુજરાત રાજ્યથી મહારાષ્ટ્ર રાજ્યમા બદલાવ પસાર કર્યો હતો. આ રજીસ્ટર્ડ ઓફીસ બદલાવ ના દરખાસ્ત થી જે કોઇ ના હીત ને અસર થતી હોય તે વ્યક્તિ કારણ દર્શાવી શકે અથવા રજીસ્ટર્ડ પોસ્ટ મારફતે તેના કે તેણીના એફીડેવીટ સાથે તેના કે તેણીના હિતના પ્રકાર અને વિરૂધ્ધના કારણો સાથે પ્રાદેશીક નિયામક, ઉત્તર-પશ્ચિમ ક્ષેત્ર, આરસોસી ભવન, રૂપલ પાર્ક સોસાયટી સામે, અંકુર બસ સ્ટોપ પાછળ, નારણપુરા, અમદાવાદ - ૩૮૦૦૧૩. (ફોનઃ ૦૭૯-૨૭૪૩૭૫૯૭, ફેક્સઃ ૦૭૯-૨૭૪૩૮૩૭૧) આ નોટીસ છપાવા તારીખથી જ (ચૌદ) દિવસમા અરજદાર કપનીના રજીસ્ટર્ડ ઓફીસ ખાતે મોક્લી શકે છે.

અરજદાર માટે અને વતી જીઆરવી જંકશન એગ્રિટેક્ટ પ્રાઈવેટ લિમિટેડ

તારીખઃ ૨૦.૦૧.૨૦૨૧

અર્જીવ સદાશીવ જંગલ ડાયરેક્ટર - ડી.આઇ.એનઃ ૦૮૮૮૯૪૫૯

કામોની કામોની મંજુરીમાં હોચ તેવા સંખ્યા કામોની સંખ્યા પ.ઝાન १६७ ह २ १६७ પૂર્વ ઝોન ₹. ह २ 9.9 २६ ૧૨ ٩ ξ ह २ З. ઉ.પ.ઝોન ४० ٩ 0 36 0 80 દ.પ.ઝોન ५८ 3 33 ૨૨ 0 ५८ ч. ઉ.ઝોન २६ 0 ٤. મધ્ય ઝોન C 9. દ.ઝોન ७उ १४६ સ્ટ્રીટલાઈટ 0 વિભાગ 66